

B.Com. Semester - 5 (CBCS) Examination
December -2020 (NEW COURSE)
Indirect Tax Law – 1 (Dse-3)

Time: 1:30 Hours

Marks: 42

Instructions:

1. Figures to the right indicate marks.
2. There are five questions in the question paper.
3. Answer any three of the following questions.

-
- પ્રશ્ન.૧ જીએસટી એટલે શું? તેના ફાયદા શું છે? (૧૪)
- પ્રશ્ન.૨ જીએસટી હેઠળ ધ્યાનમાં લીધા અને ધ્યાનમાં લીધા વિના પુરવઠાના ખ્યાલને (સપ્લાય) સમજાવો. (૧૪)
- પ્રશ્ન.૩ સેવા માટે સપ્લાયનો સમય કેટલો છે? (૧૪)
- પ્રશ્ન.૪ સપ્લાયના મૂલ્ય એટલે શું? વ્યવહાર મૂલ્યમાં કઈ વસ્તુઓ સામેલ છે. (૧૪)
- પ્રશ્ન.૫ નીચેના જવાબ આપો. (કોઈપણ બે) (૧૪)
- (અ) ભારતમાં જીએસટીની જરૂરિયાત.
- (બ) સંયુક્ત અને મિશ્રિત પુરવઠો.
- (ક) ફોરવર્ડ (આગળ) ચાર્જ હેઠળ સપ્લાયનો સમય.
- (ડ) સપ્લાયના મૂલ્ય હેઠળ એજન્ટ અને વ્યક્તિ શબ્દ સમજાવો.

ENGLISH VERSION

- Q.1 What is GST? What are its advantages? (14)
- Q.2 Explain the concept of supply with and without consideration under GST? (14)
- Q.3 What is the time of supply for service? (14)
- Q.4 What is meant by value of supply? What items are included in transaction value? (14)
- Q.5 Answer the following. (Any two) (14)
- (a) Need of GST in India.
- (b) Composite and Mixed Supplies.
- (c) Time of supply under forward charge.
- (d) Explain the term Agent and Person under value of supply.
